

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં ઉનાળાનો આનંદ!

બ્રેમ્પટન, ઓન્ટારિયો (23 જૂન 2022) – સિટી ઓફ બ્રેમ્પટન સમાજને ગમ્મતભર્યા મનોરંજનથી ઉભરાતા અવસરો આપવા ઉત્સુક છે.

શહેરની અનેક મનોરંજનની સવલતો પર પરિવાર અને મિત્રોસહ આવી આખો ઉનાળો ગમ્મતનો ગુલાલ કરો અને છબછબિયા કરો. કોઈપણ માર્ગો હવામાનને કારણે બંધ કરવામાં આવ્યા હોય, સમયપત્રકો અને નોંધણીની વિગતો સંબંધિત પ્રચાલનીય પરિસ્થિતિના અપડેટ્સ સહિત તમામ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca/summerfun.

પ્રોફેસર્સ લેક અને એલડોરાડો પાર્ક આઉટડોર પૂલ

હવામાન અનુકૂળ હશે તો પ્રોફેસર્સ લેક ખુલશે જુન 28ના રોજ. આઉટડોર સવલતો ભોગવો જેમકે લેક, બીચ અને બીચ વોલીબોલ.

હવામાન અનુકૂળ હશે તો એલડોરાડો પાર્ક આઉટડોર પૂલ જુન 30 ના રોજ ખુલ્લું મુકાશે. તે સિવાય પાર્ક પર છે બે રમતના મેદાનો, પાંચ પિકનિકના ક્ષેત્રો અને રમવા માટેની ભરપુર જગ્યા.

નોંધણીની માહિતી અને સિટીના આઉટડોર પૂલ અને બીચ સવલતો અંગેની વધારાની વિગતો માટે www.brampton.ca/summerfun ની મુલાકાત લો.

સ્પ્લેશ (છબછબિયા) પેડ અને વેડિંગ (જળ ગમ્મત) પૂલ્સ

હવે સિટીના સ્પ્લેશ પેડ્સ અને વેડિંગ પૂલ્સ રોજ ખુલ્લા રહે છે. પ્રતિકૂળ હવામાનને કારણે બંધ રહેવાની ઘટનાઓ બની શકે છે. પ્રચાલન સ્થિતિના અપડેટ્સ માટે www.brampton.ca/summerfun ની મુલાકાત લેવા વિનંતી.

સમર કેમ્પ્સ (ઉનાળાની શિબિર)

6 અને તેથી વધુ વયના સહભાગીઓ માટે જુલાઈ 4 થી ઓગસ્ટ 26 સુધી સાપ્તાહિક સમર કેમ્પ્સ ઉપલબ્ધ છે. દરેક સમુદાયના તમામ વર્ગને સમાવી લેતા કેમ્પ્સ પણ ઉપલબ્ધ છે જે ઈન્કલુઝન કેમ્પ્સ તરીકે ઓળખાય છે. બાલ્ય અને છતની નીચે થતી પ્રવૃત્તિઓ અને વિવિધ ગમ્મતભરી રમતોનો આનંદ લો. વધુ જાણકારી માટે www.brampton.ca/registerforprograms ની મુલાકાત લો.

મૂવિઝ અન્ડર દ સ્ટાર્સ

ચિંગુકુઝી પાર્ક (Chinguacousy Park), માઉન્ટ પ્લેઝન્ટ સ્ક્વેર (Mount Pleasant Square) અને ગાર્ડન સ્ક્વેર (Garden Square)માં સપ્ટેમ્બર 1 સુધી દર ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પરિવાર માટે મૈત્રીપૂર્ણ આઉટડોર નિ:શુલ્ક મૂવી સ્ક્રીનિંગ્સમાં હાજરી

આપો. પોતાના નાસ્તાપાણી, બલ્કેટ અને લૉન ચેર સાથે લાવશો. આ વર્ષે, મૂવિઝ અન્ડર દ સ્ટાર્સનું ઉદાર પ્રાયોજન મેપલ લૉજ ફાર્મ્સ, નો ફિલ્સ બ્રેમ્પટન અને ટેલસ દ્વારા થયું છે. આખું સમયપત્રક અહીં જોઈ શકાશે www.brampton.ca/summerfun.

પીલ વિલેજ ગોલ્ફ કોર્સ

સિટી ઓફ બ્રેમ્પટનની ગોલ્ફ માટેનું પ્રિમિયર સ્થળ, પીલ વિલેજ ગોલ્ફ કોર્સમાં પોતાનો ટી ટાઈમ (tee time) નોંધાવી લો. તમામ સ્તરના ખેલાડીઓ માટે નવ હોલ્સનો અનુભવ લો અને કોર્સના સૌન્દર્યને માણો. વધુ જાણકારી માટે www.brampton.ca/peelvillagegolfcourse ની મુલાકાત લો.

પાર્ક્સ અને રિક્રિએશનલ ટ્રેઈલ્સ

સિટી ઓફ બ્રેમ્પટનમાં અનેક પાર્ક્સ અને કુદરતી ધરોહરની ભૂમિ છે જેમકે ખીણો અને વૂડલેન્ડ્સ (વનરાજી) જેમાં રિક્રિએશનલ ટ્રેઈલ્સ સમાયેલ છે. બ્રેમ્પટનના સુંદર સ્થળોમાં ચાલો, દોડ લગાવો અને રમી લો. આઉટડોર ટેનિસ અને પિકલબૉલના કોર્સ તેમજ બ્રેમ્પટનના પાર્ક્સમાં આઉટડોર સ્પોર્ટ્સ ફિલ્ડ્સનો લાભ ઉઠાવીને નિરોગી રહો અને સક્રિય રહો. વધુ જાણકારી માટે www.brampton.ca/summerfun ની મુલાકાત લો.

ફિટનેસ ઈન દ પાર્ક

આ ઉનાળે બ્રેમ્પટનના પાર્ક્સમાં સિટીના મફત આઉટડોર વર્કઆઉટ્સમાં જોડાઓ. કાર્ડિયો અને ઝૂમ્બા, લો ઈમ્પેક્ટ વ્યાયામ અને યોગ, બેલેન્સ અને વેલનેસ જેવી અનેક પ્રવૃત્તિઓ માટે નામ નોંધાવો. આગ્રહ છે કે સહભાગીઓ પોતાનો ટૂવાલ, મેટ અને પાણી વગેરે સાથે લાવે અને હવામાનને અનુરૂપ આરામદાયક વર્કઆઉટ પહેરવેશ પહેરે. વધુ જાણકારી માટે www.brampton.ca/summerfun ની મુલાકાત લો.

મફત સમર સિવમ્સ

જુલાઈ 4 થી સપ્ટેમ્બર 1 સુધી આખા શહેરના રિક્રિએશન સેંટરો પર જાહેર ઈનડોર તરણકુંડોમાં નિંશુલ્ક ગમ્મત માણો. નિ:શુલ્ક તરવાની ગમ્મતના ઉદાર પ્રાયોજક ટિમ હોર્ટન્સ છે. નોંધણી આવશ્યક છે. વધુ જાણકારી માટે www.brampton.ca/summerfun ની મુલાકાત લો.

સુવાક્યો

"બ્રેમ્પટનમાં ઉનાળો અને ઉનાળાની ગમ્મતનું આગમન થઈ ચુક્યું છે! ચાલો, રમો અને છબછબિયા કરો, 2022ના આ ઉનાળામાં સ્વસ્થ રહો સક્રિય રહો કારણકે સિટીમાં આખો પરિવાર માણી શકે એવા ભાતભાતના પ્રોગ્રામ્સ અને સવલતો આકાર લઈ ચુકી છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન સુંદર ઉદ્યાનો અને રિક્રિએશનલ ટ્રેઈલ્સથી ભરેલું શહેર છે જ્યાં મોજમજની પ્રવૃત્તિઓ થશે અને દરેક વ્યક્તિને અનુરૂપ ઉનાળાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સિટીની જે રજૂઆતો આ ઉનાળામાં થનાર છે તેના પર અહીં તમે નજર ફેરવી શકશો www.brampton.ca/summerfun જેથી તમે આપણા આ મહાન બ્રેમ્પટન શહેરમાં તમારા ઉનાળાના આયોજનો કરી શકો."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"સિટીના કર્મચારીઓ બ્રેમ્પટનમાં ઉનાળામાં આનંદના ઉત્કૃષ્ટ અવસરો ઊભા થાય અને ચાલુ રહે તે માટે સમર્પિત છે. તમામ ઉંમરના અને ક્ષમતાઓ ધરાવતા લોકો આ ઉનાળે અનેક પ્રવૃત્તિઓ અને સવલતોનો લાભ ઉઠાવી શકશે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca